

Repatriations under the Vande Bharat Mission cross 5 lakhs

July 03, 2020

વંદે ભારત મિશન અંતર્ગત 5 લાખથી વધારે ભારતીયો સ્વદેશ પરત આવ્યા
જુલાઈ 03, 2020

1. વંદે ભારત મિશન (વીબીએમ) અંતર્ગત રેકોર્ડ 5 લાખ ફસાયેલા ભારતીયો સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા છે. વંદે ભારત મિશનની કામગીરીઓ 7 મે 2020 નાં રોજ શરૂ કરવામાં આવી હતી અને બે મહિનાથી ઓછા સમયમાં દૂર્ગમ ક્ષેત્રો સહિત 137 દેશોમાં ફસાયેલા 5,03,990 ભારતીયોને તેઓનાં ઘર પર પરત ફર્યા છે. ફરજ પડે તેવા કારણો ધરાવતા ફસાયેલા માત્ર 2 લાખ ભારતીયોને લાવવાનાં પ્રારંભિક લક્ષ્યાંકને ધ્યાનમાં લેતા, આ એક નોંધપાત્ર સિદ્ધિ છે.

2. કેરળમાં સૌથી મોટી સંખ્યામાં ફસાયેલા ભારતીયો આવ્યા છે (94,085), ત્યાર પછી ઉત્તરપ્રદેશ, બિહાર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને આંધ્રપ્રદેશ આવે છે. વંદે ભારત મિશન ફ્લાઈટ્સ મારફત યુએઈથી સૌથી મોટી સંખ્યામાં ફસાયેલા ભારતીયો પરત આવ્યા છે (57,305), ત્યાર પછી કુવૈત, કતાર, ઓમાન, સાઉદી અરેબિયા અને યુએસએ આવે છે અને સરહદી ચેક પોસ્ટથી જમીન માર્ગે નેપાળથી (91,193) લોકો પરત આવ્યા છે.

3. વંદે ભારત મિશનમાં 860 એર ઈન્ડિયા ફ્લાઈટ્સ; 1256 ચાર્ટર ફ્લાઈટ્સ અને 8 નૌસેના જહાજો સામેલ થયા હતા. એર ઈન્ડિયા દ્વારા પરત ફરેલા ફસાયેલા ભારતીયોની સંખ્યા 1,64,121 હતી; માલદીવ, ઈરાન અને કોલંબોથી ભારતીય નૌસેનાનાં 8 જહાજોમાં 3,987; ચાર્ટર ફ્લાઈટ્સ દ્વારા - 2,30,832 અને વિદેશી વાહકો દ્વારા - 3,969; આશરે 60 એમ્બ્યુલન્સ અને પાડોશી દેસોમનાંથી સરહદી ચેક-પોસ્ટથી જમીન માર્ગે 95,220.

4. આ મોટું ઓપરેશન વિદેશમાં ભારતીય મિશનો, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાજ્ય સરકારોનાં સક્રિય સમર્થન અને સહયોગથી પાર પાડવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે વરિષ્ઠ અધિકારીઓને રાજ્યનાં સંકલનકર્તાઓ તરીકે પદનામિત કર્યા હતા, જેઓ તમામ સ્તરો પર સહજ સમન્વયની ખાતરી આપતા આ ઓપરેશનોમાં બંધાથી આગળ રહ્યા હતા.

નવી દિલ્હી

જુલાઈ 03, 2020

DISCLAIMER : This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.